

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૨/૦૬/૨૦૧૬ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૨૩/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૭ કેસ કરી, ૩૪ વ્યક્તિઓને ઝડપી, ૧૩૭ લીટર દેશી દારૂ, ૧ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧૫૧ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૪૮ બિયર ટીન અને ૧ કાર કબજે કરી હતી.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૦૨૪/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૨૩૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૩ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

અપહરણ:-

સમાચાર યાદી નં.૧૦૨૫/૧૬

કૃષ્ણનગર: આશાબહેન શંકરભાઈ ચૌહાણ (ઉ.વ.૧૬)(રહે.ઈન્દીરાનગર ભરવાડવાસ ગોપાલ ચોક પાસે કૃષ્ણનગર) ને તા.૨૯/૫/૧૬ બપોરના ૧/૦૦ વાગ્યાના સુમારે ઠક્કરનગર વિરલ કોમ્પ્લેક્ષ નજીકથી આરોપી અનિલ મહેશભાઈ પટેલ (રહે.વેણુ ગોપાલ સોસાયટી ઉમા વિદ્યાલયની બાજુમાં કૃષ્ણનગર) લગ્ન કરવાની લાલચ આપી લાલચાવી ફોસલાવી જારકર્મ કરવાના ઈરાદે ભગાડી લઈ ગયો છે. આ અંગેની ફરીયાદ આશાબહેનની માતા શાંતાબહેન ચૌહાણે તા.૧/૬/૧૬ નારોજ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી સી આર સંગાડા ચલાવે છે.

નિકોલ: ભરતભાઈ બાવચંદભાઈ ગજેરા (રહે.એમ શાંતી રેસીડેન્સી સેવન ૬ સ્કૂલની સામે નિકોલ) એ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૩૧/૫/૧૬ કલાક ૯/૩૦ થી ૧૨/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના રહેણાંક નજીકથી પોતાની પુત્રી અવની (ઉ.વ.૧૬) ને અજાણી વ્યક્તિ અપહરણ કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી એચ જે ચૌધરી ચલાવે છે.

ઉચાપતની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૧૦૨૬/૧૬

સરખેજ: ગણેશ દામાજી ચોટે (રહે.પ્લોટ નંબર-૩૦ પામલા રોડ ઈસ્ટ નરકેસરી સોસાયટી જયપ્રકાશનગર નાગપુર) એ તા.૧/૬/૧૬ નારોજ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે માહે મે ૨૦૧૫ થી તા.૨૧/૪/૧૬ સુધીના સમયગાળા દરમ્યાન સરખેજ સાગર એસ્ટેટ ગોડાઉન વેર હાઉસ ખાતેથી આરોપી (૧) મૌલીક હરીનભાઈ શાહ (રહે.સીમા હોલ પાસે સેટેલાઈટ) અને (૨) રાકેશકુમાર જીતેન્દ્રકુમાર જોષી (રહે. જોષી ટેકરા ગામ ચુલેણ તાલુકો મહુધા જીલ્લો ખેડા) એ ભેગા મળી કંપનીના ગોડાઉનમાંથી વોટર પુફિંગ અને બીકુમીન પ્રોડક્ટનો માલ કિંમત રૂપિયા ૧૫,૦૭,૦૨૭/- ઉચાપત કરી કંપની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી એસ ઈસરાની ચલાવે છે.

અપમૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૦૨૭/૧૬

સાબરમતી: સાબરમતી ચેનપુર ગામ દેવ ઓરમ નામની સાઈટ ઉપર રહેતા અને ત્યાજ સાઈટ ઉપર કામ કરતા કાળુભાઈ વેરજીભાઈ રોટ (ઉ.વ.૩૫) સાઈટ ઉપર કામ કરતા હતા ત્યારે તા.૧/૬/૧૬ સવારના ૧૧/૦૦ વાગ્યાના સુમારે સાઈટ ઉપર પ્રથમ માળેથી પટકાઈ ગયા હતા. સારવાર માટે સોલા લાઈફ લાઈન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બપોરના ૨/૪૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી દિનેશભાઈ મંગુભાઈ ચલાવે છે.

સાપ કરડતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૦૨૮/૧૬

રિવરફ્રંટ ઈસ્ટ: કાંતીભાઈ શામજીભાઈ પટેલ (ઉ.વ.૫૦) (રહે. આશારામ આશ્રમ મોટેરા) ને તા.૧/૬/૧૬ સવારના ૮/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘર નજીક પગ ઉપર સાપ કરડ્યો હતો. સારવાર માટે સીવીલ હોસ્પિટલ લઈ જતા ફરજ પરના ડૉ.શ્રીએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે રિવરફ્રંટ ઈસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે કો શ્રી અજીતસિંહ જવાનસિંહ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૧૦૨૯/૧૬

નરોડા: મોનિકાબહેન અશોકભાઈ જૈન (ઉ.વ.૧૭) (રહે.શ્રી રામ એપાર્ટમેન્ટ સુતરના કારખાના નરોડા) ધોરણ -૧૦ મા નાપાસ થતા હતાશ થઈ તા.૧/૬/૧૬ સવારના ૭/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરના ધાબા ઉપરથી પડતું મુકી આત્મહત્યા કરી હતી. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે કો ભીખાભાઈ જીવાભાઈ ચલાવે છે.

શહેરકોટડા: હરેશભાઈ હરજીભાઈ મકવાણા (રહે.અશોકમીલ નરોડા રોડ) એ કોઈ કારણસર તા.૩૧/૫/૧૬ રાતના ૧૦/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પોતાની જાતે શરીર ઉપર કેરોસીન છાંટી સળગી ગયા હતા. સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન તા.૧/૬/૧૬ બપોરના ૪/૦૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે શહેરકોટડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી ગણપતસિંહ વખતસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.